



સત્તામી સવારની..

કરો'તી ઘૂમવાની લેયારી, મોજ ખોવાઈ ગઈ!
નવરાત્રના ઉંગાળી મજા જ ઘોવાઈ ગઈ!
કોહવાઈ ગઈ'તી આગાહીઓ લાગી વરસા -
ફેટીંગ અને મિલન-મૂલાકાતો રોવાઈ ગઈ!

બ્યારસાપકો !!
લ્યો ! કરો આયોજન -
'છીરી ગરબા'!

હે માં ! પદ્ધારો -
કાદવ કોડ માં -
ઘૂમો ગરબો !!

ચિંતન

વસ્તુસિદ્ધિ: વિચારેણ ન કિંબિંત કર્મકોટિભિ: ।
ઉપરોક્ત જ્ઞાન વિષેકૃતામણિ ગંભીરાંથી લેવામાં આપેલ છે.
વસ્તુસિદ્ધિ હોલે કે આમભતની આગામ વિચારાની, મનન-ચિંતન-નિર્દિદ્યાસનની જ થાય છે, નાંની કરોડો કર્માં.

આમ કદેવાનું કાશાનો એ છે કે જ્યાં જ્યાં કર્મ છે, કૃત્ય છે, ત્યાં ત્યાં કર્તાભાવ છે, અંભેભાવ છે, ને એ જ આપણી અનુભૂતિમાં અવરોધાય છે. પ્રયત્નો કરવાની, કર્મ કરવાની, જે કર્તાભાવ થાણો થાયો હોય છે, અંભેભાવ રહેલો છે, તેને લીધે બધા દુઃખી છે, દુઃખી કરનાર કર્મ નથી પણ કર્તાભાવ છે.

ને પછી કદેવાનું છે કે જ્યાં કર્તાભાવ નથી ત્યાં જે કાંઈ કર્મ થાય છે તે સહજપણે, સ્વભાવપણ થાયાં કરતાં હોય છે, તે કરતાં પડતાં નથી, પ્રયત્ન નથી, કોઈ સંકલ્પ નથી. પછી તે પોતા મારો હોય કે અન્ય મારો, જે તે મારો શરાણાગત છે, સમર્પણ જ છે. એવા જ્ઞાનના વોગણેના વિના પછી પરમાત્મા પોતે જ કરે છે.

સુવિચાર

- હૃદય સુધીની યાત્રા ઇથરને પ્રગત કરી શકે છે,
- ઈથરની શુદ્ધાંગા માટેનું પ્રેમથ પગિયું છે પ્રાર્થના - જીવન પાયેચ
- શુદ્ધ કાર્યો માર્ગ અનુભૂતિ હી પણ શુદ્ધ જ છે એને અનુભૂતિ કાર્યો માર્ગ અનુભૂતિ હી પણ શુદ્ધ જ છે - એસો. ભજાચાર્ય
- માઝાસ ધર્મને અનુભૂત તે ઉત્તમ છે, પરંતુ ધર્મપાલન કરે છે તેવા ભભક કરે, પ્રદર્શનો કરે, ઉજવણી કરે ત્યારે ખૂબ દુઃખ થાય છે - એશો
- આજ તમાં જીવાના માર્ગની વાત સુધી વિશે નથી - ડૉ. શેલેશ ટાકર
- એ લોકોને મધ્યપૂર્વાનું તાજુ મધ્ય માર્ગ છે તેઓ મધ્યપૂર્વાના હંગામી ગભરાયો તે તેમ ચાલરો?
- ઈથર અવતારો એ અવતરવાનું હોય નથી. તે માઝ સરાણાગત છે, સમર્પણ જ છે.
- આજાનું ઓપરથ: ગાયના છાણાની ચાંપીની રાખ ચોપડવાથી શીશસમાં રાહત થાય છે.

(સંકળન: દીપક વી. આશારા)

નોંધકાય

લાકડા વરેરવાની લાટીમાં એક જેપી સાપ ઘૂમી ગયો. સાપ સરકોર સરકોરો એક જીમન પર પડેલી કરવત સાથે ઘસાયો. એને કરવતનો ઢાંનો ઘસાવાથી નજીવી ઠિક થઈ. સાપને ગુસ્તો આવ્યો એટેકે તેણે પાણ વળીને કરવતને લોએરાં દરશા ઠાક દીધો. આમ કરતાં સાપના મુખમાં બાંધ મોટી ઠિક થઈ. સાપને થયું કે કરવત ને લોએરાં દરશા ઠાક દીધો. એને તેણે ફરી વાર કરવતની ફરતે વીટાળાઈન એક લોએરાં દરશા ભરતો વાંચે કરે ત્યારે ખૂબ દુઃખ થાય છે. પરંતુ ધર્મપૂર્વક રહેલો વિશે એને પરિણામે સાપ મૃત્યુ પામ્યો. તારસા એક: કોઈએ આપણાને નુકશાન પણેનાં હોય નથી - શેકસપિયર

તે માઝસમાંથી મહુયુરુપે પ્રગત થાંની હોય છે - સંત અ૽ગાસ્ટન

(સંકળન: દીપક વી. આશારા)

નવરાત્રી એટલે ગુજરાતી સંસ્કાર અને સંસ્કૃતિની આગામ, ભારતીય પરંપરાનું પર્વ, ધર્મ, શ્રદ્ધા, શક્તિ, અભિજન અને આધુનિકતાનો સંગમ. નવરાત્રી એટલે ઊસ્સાં, કીજી, એતાં, સપના, સોફ્ટિય અને આરાધનાનો મહોસુસ. નવરાત્રી એટલે ગુજરાતી કલા, સંગીત, સાહિત્ય, અને આંતરિક આશાધનાની વેચિક આગામ.

નવરાત્રીનું અનેક રીતે આપણા જીવનમાં મહત્વ છે. અસત્ય સામે સત્યનો વિશ્વાસ, નકારાત્કાતાસામે સાપનાની પ્રતિમુખી સામાન વિરાસત વિશ્વાસાની અંત, અંહાર અને એટાંચાં મોટી પછાડ, આમ થત્યાં સત્તા પણ પરાયા. અને એ પણ એક નારીને કારણે. નારી શક્તિને એંગે પક્ષકી જેણું નથી. એને પછીને એંગે પક્ષકી જેણું નથી.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભાગ નથી. અને યોગે આપણાને જીવનમાં અનુભૂતિ હોય છે. નારીની વેચિકની રીતે પણ મહત્વ છે.

નારીની વેચિકની રીતે પણ મહત્વ છે. આ આસો મહીનો એટલે પરિવતનો ભા